

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ૭૫માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા ૭૫માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તા.૧૫/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૮.૩૦ કલાકે યુનિવર્સિટી ભવન ખાતે માન. કુલપતિશ્રી ડૉ. કે.બી. કથીરીયાના વરદ હસ્તે ધ્વજ ફરકાવી કરવામાં આવેલ. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પ્રવર્તમાન નોવેલ કોરોના વાઈરસ (કોવીડ-૧૯) ના સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરીને યુનિવર્સિટીના સર્વે અધિકારીશ્રીઓ, ડીનશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વસાહતી ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે માન. કુલપતિશ્રી ડૉ. કે.બી. કથીરીયા દ્વારા પ્રાસંગિક પ્રવચનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામને ૭૫ માં સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા પાઠવેલ. દેશભરમાં ૭૫માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 'આઝાદી કા અમૃત મહોત્સવ' તરીકે થઈ રહી છે તે વિશે માહિતી આપી હતી. દેશની આઝાદી દરમ્યાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરેલ, નમન કરેલ અને માં ભોમની રક્ષા કાળે શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાસુમન અર્પિત કરેલ. આઝાદી પછી અત્યાર સુધી દેશે તમામ ક્ષેત્રે હરણુફાળ ભરી છે તે બાબતે પોતાના વિચારો રજૂ કરેલ. તાજેતરમાં ભારત દેશે રમત-ગમત ક્ષેત્રે ઓલિમ્પિકમાં મેડલો જીતી દેશને ગૌરવ અપાવ્યુ છે તે અંગે જણાવેલ. હાલનાં સમયમાં કોરોના મહામારીમાં પોતાના જીવના જોખમે કાર્ય કરી રહેલ કોવીડ વોરીયરની સેવાઓને પણ બીરદાવેલ તેમજ તમામને કોરોના વેકિસન લેવા અપીલ કરી હતી. કોરોના મહામારીમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના અવસાન પામેલ કર્મચારીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરેલ. આણંદ કૃષિ યુનિવર્સિટીની બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરના પણ ૭૫ વર્ષ પૂર્ણ થયેલ છે તે અંગે પણ જણાવેલ. યુનિવર્સિટીના સર્વે અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે જે ઝડપથી પ્રગતિ કરી રહેલ છે તેમાં હજુ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે તેવું આહવાન આપેલ. કેપ્ટન પી.એ ગોહિલે દ્વારા પરેડ કમાન્ડન્ટ તરીકેની ફરજ બજાવેલ. કાર્યક્રમના ઉદઘોષક તરીકેની કામગીરી શ્રી એમ.એ. મકવાણા દ્વારા કરવામાં આવેલ. ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ થયા પછી માન. કુલપતિશ્રી તેમજ અન્ય યુનિવર્સિટી અધિકારીઓ દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉ. એમ.ડી. પટેલ, શ્રી કનૈયાલાલ મુનશીની પ્રતિમાઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ. અંતે યુનિવર્સિટી ભવનના પરીસરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ ડૉ. દિનેશ એચ. પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.

